

ત્વરિત જાહેરાત માટે

સીટીએ પોતાનો પહેલો એક્સ્પ્લોર બ્રેમ્પટન યુથ પાસ શરૂ કર્યો

નવો પાસ બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ભાડા રહિત (ફ્રી ફેર) સગવડ પૂરી પાડશે,
બ્રેમ્પટનના જુવાનિયાઓ માટે પસંદ કરેલા બ્રેમ્પટન મનોરંજનલક્ષી કાર્યક્રમોની મફત પહોંચ પૂરી પાડશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 19, 2022) – સીટી ઓફ બ્રેમ્પટને પોતાનો એક્સ્પ્લોર બ્રેમ્પટન યુથ પાસ પાઈલોટ પ્રોગ્રામ શરૂ કર્યો છે.

આ પાસથી, 12 થી 16 વર્ષના જુવાનિયાઓ જેઓ બ્રેમ્પટનવાસીઓ હોય તેઓ બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ભાડા રહિતનો લાભ મેળવશે અને પસંદ કરેલા બ્રેમ્પટન રિક્રિએશન ડ્રોપ-ઇન પ્રોગ્રામ્સમાં મફત પહોંચ મેળવશે, જેમાં જુલાઈ 1 થી સપ્ટેમ્બર 5, 2022 સુધી સ્વીમિંગ, સ્કેટિંગ અને પસંદગીની રમતો સામેલ છે.

સીટી પાસે આ પાઈલોટ પ્રોગ્રામ મારફતે 2,000 એક્સ્પ્લોર બ્રેમ્પટન યુથ પાસીસ ઉપલબ્ધ છે. નબળા જુવાનિયાઓને અગ્રતા આપવામાં આવશે. પાઈલોટ પ્રોગ્રામ બ્રેમ્પટનમાં સક્રિય જીવનશૈલી અને આરોગ્યપ્રદ ટેવો પાડવાનો પાયો નાખીને, પબ્લિક ટ્રાન્ઝિટ અને મનોરંજન સગવડોનો ઉપયોગ કરવા જુવાનિયાઓને પ્રોત્સાહિત કરે છે.

અરજીઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે. [એક્સ્પ્લોર બ્રેમ્પટન યુથ પાસ વિશે વધુ જાણવા અને અરજી રજૂ કરવા અહીં ક્લિક કરો.](#)

ક્વોટ્સ (અવતરણો)

“અમે સમર 2022 માટે બ્રેમ્પટનનો પહેલો એક્સ્પ્લોર બ્રેમ્પટન યુથ પાસ શરૂ કરવામાં રોમાંચ અનુભવીએ છીએ. બ્રેમ્પટન પ્રીમિયર ટ્રાન્ઝિટ અને મનોરંજન સગવડો ધરાવતું, કેનેડામાં સૌથી જુવાન શહેરોમાંનું એક શહેર છે, અને હું જુવાનિયાઓને આ પાસનો લાભ લેવા અને મોજમજા કરવા, સુરક્ષિત અને વધારે પરવડી શકતા ઉનાળાનો લાભ લેવા પ્રોત્સાહિત કરું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન એક આરોગ્યપ્રદ અને સુરક્ષિત શહેર, તકો આપનારું અને હરિયાળુ શહેર છે. આપણાં જુવાનિયાઓ આવતીકાલે આપણાં આગેવાનો છે, અને આપણે બ્રેમ્પટનના વૈવિધ્યસભર અને ગતિશીલ જુવાનિયાઓના સમુદાયને આરોગ્યપ્રદ અને સક્રિય રહેવાની તકો પૂરું પાડવાનું ચાલુ રાખીએ છીએ, જેમ કે એક્સ્પ્લોર બ્રેમ્પટન યુથ પાસ. આ આપણાં શહેરમાં જુવાનિયાઓ માટેની પહેલોમાં સીમાચિહ્નરૂપ છે!”

- રોવિના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટનનો એક્સ્પ્લોર યુથ પાસ આપણાં શહેરના જુવાનિયાઓ પ્રત્યે આપણું સતત સમર્પણ દર્શાવે છે. જુવાનિયાઓની વૃદ્ધિ અને વિકાસની તકો માટે સીટીની પોતાની ઉત્કૃષ્ટ કટિબદ્ધતા માટે ગત થોડાક વર્ષોમાં ત્રણ વખત ઓળખ મળવા બદલ, પ્લે વર્સ પાસથી પ્લેટિનમ સ્ટેટસનો જુવાનિયાઓને અનુકૂળ સામુદાયિક હોદ્દો મળવા બદલ સીટી ગૌરવ અનુભવે છે, આ પ્રોગ્રામને પાર્કર્સ એન્ડ રિક્રિએશન ઓન્ટેરિયોનો ટેકો છે.”

- શાર્મેઇન વિલિયમ્સ (Charmaine Williams), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 7 અને 8; ઉપ-પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી આપણાં શહેરમાં બ્રેમ્પટનના જુવાનિયાઓની વૃદ્ધિ અને વિકાસને ટેકો આપવા તેઓને પ્રવૃત્તમય રાખવા કટિબદ્ધ છે. બ્રેમ્પટન રહેવાનું, કામ કરવાનું અને રમત રમવાનું ચડિયાતું સ્થળ છે, અને અમે આપણાં જુવાનિયાઓને સફળ થવામાં મદદ કરવાનું મહત્વનું કામ ચાલુ રાખીશું.”

- પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના મુખ્ય વહીવટી અધિકારી (ઈન્ટરીમ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર), સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca